

માર્ચ 13, 2018

2018 ની બ્રામ્પટન વિઝિટર ગાઈડ (મુલાકાતી માર્ગદર્શિકા) હવે ઉપલબ્ધ છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – દરેક વ્યક્તિ માટે કંઈક અર્પણ કરવા, 2018 બ્રામ્પટન મુલાકાતી માર્ગદર્શિકા હવે ઓનલાઈન સોફ્ટ કોપીમાં અને છાપેલી હાર્ડ કોપીમાં ઉપલબ્ધ છે. આ માર્ગદર્શિકા રહેવાસીઓ અને મુલાકાતીઓને સમગ્ર બ્રામ્પટનમાં જોવાલાયક અને કરવાલાયક તમામ રોમાંચક અને મોજમજની બાબતોનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. માર્ગદર્શિકા વાચકોને શહેરમાં આજુબારી શોધ અને અપવાદમય સ્વરૂપે આકાર પામેલા અજોડ સ્થળો લક્ષમાં લેવા પ્રોત્સાહિત કરે છે.

આ માર્ગદર્શિકા બ્રામ્પટનનું પ્રદર્શન નીચેની બાબતો મારફતે કરે છે:

- પ્રમાણભૂત રાંધણકળા સંબંધિત અનુભવો
- સમુદાયના પ્રખ્યાત સભ્યો
- લોકોને સાથે લાવતા તહેવારો અને પ્રસંગો
- લાક્ષણિક પ્રવૃત્તિઓ અને આકર્ષણો
- ગમ્મિત કુદરતી સ્થળો અને જંગલી કે પહાડી પગદંડીઓ
- કંપાયમાન કળા અને સાંસ્કૃતિક સમુદાય

2018 ની બ્રામ્પટન મુલાકાતી માર્ગદર્શિકા ટુરિઝમ ટોરોન્ટો, ઓન્ટેરિયોની પ્રાદેશિક ટુરિઝમ સંસ્થા #5, અને સીટી ઓફ બ્રામ્પટન સાથેના સહયોગમાં બનાવવામાં આવી છે. આ માર્ગદર્શિકાની નકલો સમગ્ર ઓન્ટેરિયોમાં ટુરિઝમ ઇન્ફર્મેશન સેન્ટર્સ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, હોટેલ્સ, ઇન્ડસ્ટ્રી ટુર ઓપરેટર્સ અને ઘણાંને વિતરિત કરવામાં આવી છે.

રહેવાસીઓ અને મુલાકાતીઓને છાપેલી નકલ બ્રામ્પટન સીટી હોલમાંથી મેળવી લેવા અથવા [ટુરિઝમ બ્રામ્પટનની વેબસાઈટ](#) પર ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક આવૃત્તિ ડાઉનલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અવતરણ (ક્વોટ):

“તમે શહેર બહારના મુલાકાતીઓના યજમાન બન્યા હો કે પછી તેઓ તમારા શહેરને વધારે સારી રીતે જાણે તેમ તમે ઈચ્છતા હો, તમારું આયોજન કરવા મુલાકાતી માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. આ માર્ગદર્શિકા તમને અમારા શહેરના પર્યટક આકર્ષણો શોધવામાં, મુખ્ય તહેવારો, પ્રસંગો અને સમતગમતની ટુર્નામેન્ટ્સમાં હાજર રહેવામાં, તેમજ અમારા ઘણાં ઉદ્યાનો અને જંગલી કે પહાડી પગદંડીઓ શોધવામાં મદદરૂપ થશે. જુવાન અને સાંસ્કૃતિક રીતે સક્રિય, બ્રામ્પટન તમારે આનંદ લેવા માટે ઉત્સવો, તહેવારો અને મનોરંજનથી વ્યાપકપણે ભરપૂર છે. બ્રામ્પટનમાં કરવાલાયક કંઈક રોમાંચક હંમેશા હોય છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca